

# ભારતનાં પક્ષીઓની સ્થિતિ ૨૦૨૦



ભારતનાં પક્ષીઓની સ્થિતિ વિશે ૧૫૦૦૦ થી વધુ પક્ષીનીરીક્ષકો અહેવાલ આપે છે



V. SANTHARAM

## આ અહેવાલ શું કહે છે?

- ભારતનાં ૮૬૭ જાતિઓનાં પક્ષીઓનાં લાંબા ગાળાનાં વલણ, વર્તમાન વલણ, વિતરણ શ્રેણીનો વ્યાપ અને એકંદર સંરક્ષણ સ્થિતિનું મૂલ્યાંકન
- ઈબર્ડ (વેબસાઈટ અને એપ) પર ૧૫૦૦૦થી વધુ પક્ષીનીરીક્ષકો દ્વારા યોગદાન આપેલા ૧ કરોડથી વધુ અવલોકનોનાં આધારે

## કેટલાક ખુશ ખબર



- છેલ્લા ૨૫થી વધુ વર્ષોમાં ૧૨૬ જાતિઓની સંખ્યા સ્થિર છે અથવા વધી રહી છે
- આપણા હૃદયસ્પર્શી પક્ષીઓ, જેમ કે ઘર ચકલી અને મોરની સંખ્યા સારી એવી નોંધાય છે
- સફેદ કાંકણસાર અને સર્પગ્રિવા સહિત વૈશ્વિક સ્તરે સંકટગ્રસ્ત કેટલીક જાતિઓની સંખ્યા સ્થિર છે અથવા વધી રહી છે જેથી ભારત માટે તેમને નિયત દરજ્જાનાં સંરક્ષણ સ્તરમાં વર્ગીકૃત કરવામાં આવેલ છે.

## ચિંતાજનક કારણો

- શિકારી પક્ષીઓ, કાંઠાનાં યાયાવર પક્ષીઓ (વેડર) અને પશ્ચિમી ઘાટનાં સ્થાનિક પક્ષીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
- નાનો રાજલાલ, લીલાપગ અને ભરત ચંડુલ (સ્કાય લાર્ક) જેવી સામાન્ય જાતિઓની સંખ્યામાં ઘટાડો થયો છે
- અમેરંદંડી જીવોને ખાનાર પક્ષીઓમાં સામૂહિક ઘટાડો નોંધાયો છે

## પક્ષીઓની સ્થિતિનાં મૂલ્યાંકનો

વિવિધ શ્રેણીઓમાં જાતિઓની સંખ્યા. જાતિઓને સંરક્ષણ સ્તરની વિવિધ શ્રેણીઓમાં મૂકવા માટે વિપુલતા અને વિતરણ વ્યાપના કદનો ઉપયોગ થાય છે.



ઉચ્ચ

## CONSERVATION CONCERN



## ભલામણો

### નીતિ નિર્માતાઓ અને સંચાલકો

- આ અહેવાલમાં આપેલ સંરક્ષણ આકારણીઓનો ઉપયોગ કરીને વૈશ્વિક મૂલ્યાંકનોને અપડેટ કરો
- આર્થિક ભંડોળ દ્વારા વધુ કાળજી લેવા જેવી જાતિઓ અને આવાસ સ્થાનો કે જ્યાં જાતિઓ ઘટતી જાય છે ત્યાં વધુ સંરક્ષણનાં પ્રયત્નો કરો
- નાગરિક વૈજ્ઞાનિકો અને સંશોધકો દ્વારા થતા દેખરેખના પ્રયત્નોને ટેકો આપવો

### સંશોધકો

- સંશોધકો અને જાહેર લોકો વચ્ચેના સહયોગને પ્રોત્સાહન આપો
- અવગણેલ જાતિઓને વધુ સારી રીતે સમજવા માટે પ્રયત્નો શરૂ કરો
- સંખ્યા ઘટવાના કારણોની તપાસ કરો

### જાહેર પર્યાવરણ પ્રેમી જનતા

- પક્ષીદર્શન દરમિયાન નોંધાયેલ પક્ષીઓની સૂચી ઈબર્ડ જેવા જાહેર મંચ પર અપલોડ કરો
- જે વિસ્તારોમાં ઓછું પક્ષી નિરીક્ષણ થાય છે તેવા વિસ્તારોનાં પક્ષીઓની સૂચી બનાવી માહિતીની ઘટ પૂરી કરો
- પક્ષી નિરીક્ષણ વિશે વધુ જાગૃતિ લાવી, અને પ્રાદેશિક દેખરેખના પ્રયત્નો શરૂ કરો

Translated by:  
Dhaval Vargiya & Sarman Ratiya

